



पेंशन निधि विनियामक और विकास प्राधिकरण
Pension Fund Regulatory and Development Authority
A Public awareness initiative on old-age income security

निवृति आयोजन अने बचत

औपचारिक पेन्शन व्यवस्था भारतमां मात्र १३% देशना चुकवाइ पात्र कर्मचारीओने आवरी ले छे. तेथी एक आरामदायक सेवानिवृतिनो आनंद लेवा भाटे तमारे नियमित बचत अने रोकाण करवानी ज़रूर छे.

नियमित अने व्यवस्थित रोकाण निवृति आयोजनानो एक अभिन्न भाग छे. ते समजवृं ज़रूरी छे के लांबा गाणे एक व्यक्तिनी नाडाकीय सळखता स्थिति ते रोकाण केवी बुद्धिमानीथी अने सतत करे छे तेना पर निर्भर करे छे.

निवृति आयोजनानी योजनामां परिश्रम, शिस्त, त्याग, सातत्य अने धीरज नी ज़रूर होय छे.

एनपीऐस-एक मूल्यवान सेवा निवृति योजना

हेतु

शिस्तबद्ध रीते नियमित बचत अने काम पछीना ज़वन माटे धीरे धीरे कोर्पसनुं निर्माण एनपीऐस मां सेवानिवृति भाटे रोकाणानो एक प्राथमिक हेतु छे.

लांबा समय सुधी आयोजन क्षितिज

एनपीऐस पोताना रोकाण संचय अने विकास भाटे पूरतो समय आपी तैयार करवामां आवेल छे.

जोखम भाटे जोगवाई


एनपीऐस पोताना सेवानिवृति पछीना वर्षो माटे बचत छे, ज्यारे सामान्य रीते तमे भध्यम जोखमनी सरभामणीमां वधारे लेवानुं पसंद नहीं करो तेवी एक विशिष्ट समज साथे डिजाइन करवामां आवेल छे.

वर्णतर्नी अपेक्षा

वर्णतर कोई पाण रोकाण भाटे प्राथमिक प्रेरणा शक्ति छे. वास्तविक वर्णतर मात्र लांबा समय उपर निर्धारित करी शकाय छे. ओष्ठा समयमां वधारे अव्यवस्थित वर्णतर छे. लांबा समय भाटे एक उत्पादक होवाने नाते एनपीऐस सभानपणे आ सिद्धांत ने माने छे.

नज्ञकुन्नु मूल्यांकन

एनपीऐस हेठળ दरेक समये तमारा हितोनी रक्षा करवा भाटे रोकाणोनुं सतत अने नज्ञकुन्नु मूल्यांकन करे छे.



तमे एक दिवस कदाच छांयामां बेसी शको छो
कारणा के घणा समय पहेलां तमे एक
रोपो वाव्यो छे !!!!



...आजे १०० करोड उपर
भारतीयोंसे जनभ लीघो छे जे
८० वर्ष उपर ज्वशे...

NPS भा भाटे ?

- ओष्ठी खर्चाण योजनाछे.
- व्यक्तिगत, कर्मचारीओ अने नोकरीदाताओ भाटे कर राहत
- आकर्षक बजारी संकल्पयेल वर्णतर
- सलामत, सुरक्षित अने सरण रीते सुवाहा
- पेन्शन फँडना अनुभवी निष्ठातो द्वारा व्यवस्थापन
- कायदा द्वारा स्थापित नियमन कर्ता PFRDA द्वारा नियमन

NPS हुं छे ?

जे वधु सक्षम, टेक्नोलोज आधारित प्रणाली छे जेमां सेकन्ड इनिंग भाटेनी बचत भाटे भंडोण एकहुं करवा अत्यारथी थोडी थोडी बचतनी शरुआत करवामां आवे छे.

कोणा जोडाई शके छे ?

जो तमे नीये दर्शावेल योग्यता धरावो छो तो तमे जोडाई शको छो :

- भारतना नागारिक - रहेवासी के बिन रहेवासी
- जोडाता समये १८-६० वर्षनी उमर
- वेतन भेणवता के पोतानो व्यवसाय धरावता होव

हुं NPS भातुं क्यां खोलावी शकुं ?

PFRDA द्वारा मान्यता प्राप्त कोई पाण पेन्शन सुविधा पूरी करनार केन्द्र (POP-SP)नी मुलाकात लाइने.

NPS विषे वधु जाणवा भाटे अने तमारां नज्ञकना POP-SP जाणवा भाटे टोल फँकी नंबर पर कोल करो

1800 110 708

OR

SMS NPS to 56677*

*प्रमाणभूत खर्च लागु.

OR

तमारां वेबसाइटनी

www.pfrda.org.in

DAVP/15102/13/0017/1415